



B. R. S. (Sem. V) (CBCS) Examination

October - 2017

Agro - 503 : Agronomy

(Core - 15)

(New Course)

Faculty Code : 009

Subject Code : 001520

Time : 2 Hours]

[Total Marks : 50

- 1** મગફળીના ધર્છના ઓળખના ચિનહો, નુકશાનનો પ્રકાર જીવનક્રમ,
કાયાંતરણ, યજમાન પાકો તથા સંકલીત ક્રીટક નિયંત્રણ સમજાવો. **10**

અથવા

- 1** કપાસના રૂપલાના ઓળખના ચિનહો, નુકશાનનો પ્રકાર, જીવનક્રમ, કાયાંતરણ,
યજમાન પાકો તથા સંકલીત ક્રીટક નિયંત્રણ સમજાવો. **10**

- 2** નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો વિગતે ઉત્તર લખો : **10**

- (૧) કપાસના ખુણીયા-ટપકાંના રોગ માટે અનુકૂળ હવામાન, ઓળખના ચિનહો
તથા નિયંત્રણ વ્યવસ્થા સમજાવો.
(૨) બાજરીના અરગટ માટે અનુકૂળ હવામાન, ઓળખના ચિનહો તથા નિયંત્રણ
સમજાવો.

- 3** નીચેનામાંથી કોઈ પણ ત્રણ ટૂંકનોંધ લખો : **14**

- (૧) ગુલાબી ઈયળનાં સંકલીત જીવાત નિયંત્રણ
(૨) લશકરી ઈયળના ઓળખના ચિનહો તથા નુકશાનનો પ્રકાર
(૩) મોલો
(૪) તલનો ફાયલોડીનો રોગ
(૫) તમાકુની ગાઠીયા માખી

- ૪ નીચેનોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો : ૧૫
- (૧) લીલી ઈયળમાં કાયાંતરણ તથા ધજમાન પાકો જણાવો.
 - (૨) તમાકુમાં આવતા કીટકો જણાવી, કોઈ પણ એક કિટકના ઓળખના ચિનહો જણાવો.
 - (૩) બાજરીના કમાશીયા કઈ રીતે નુકશાન કરે છે ? તે સમજાવો.
 - (૪) સફેદ માખીનું નિયંત્રણ સમજાવો.
 - (૫) કપાસની ટપકાંવાળી ઈયળના જૈવિક નિયંત્રણ લખો.
 - (૬) મગફળીમાં ટીકકાના રોગનું નિયંત્રણ જણાવો.
 - (૭) તમાકુંમાં પંચરંગીયાના રોગના ઓળખના ચિનહો લખો.
-